



مجلس إدارة جامعة النجاح الوطنية
مجلس إدارة جامعة النجاح الوطنية،
مجلس إدارة جامعة النجاح الوطنية

مجلس إدارة جامعة النجاح الوطنية: كعضو في مجلس إدارة جامعة النجاح الوطنية، أقرت جامعة النجاح الوطنية، في جلستها رقم 10، بتاريخ 2022/07/27، القرار رقم 10، والذي يقر فيه المجلس إدارة جامعة النجاح الوطنية، بقبول طلب الالتحاق بالدراسة الجامعية، للطلاب المتقدمين للدراسة الجامعية، في جامعة النجاح الوطنية، في التخصصات المذكورة في الجدول التالي.

القرار رقم: (IUL)213-PR/213/2022/77

26 من تموز 2022

مجلس إدارة جامعة النجاح الوطنية
رئيس المجلس إدارة جامعة النجاح الوطنية

අංක 1

පොදු විෂය

පොදු විෂය	ප්‍රධාන විෂය
<p>සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව</p> <p>(IUL)213-PR/213/2022/77</p> <p>2022 අගෝස්තු 26</p>	<p>1.1</p>
<p>සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව</p> <p>2022 අගෝස්තු 05</p> <p>13:30</p>	<p>8.1</p>
<p>සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව</p> <p>3305420</p> <p>procurement@polytechnic-edu-mv</p>	<p>8.2</p>
<p>සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව</p> <p>2022 අගෝස්තු 12</p> <p>11:00</p>	<p>17.2</p>
<p>සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව</p> <p>2022 අගෝස්තු 12</p> <p>11:00</p>	<p>19.1</p>
<p>සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව</p> <p>6</p>	<p>22.1</p>
<p>සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව</p>	<p>27.1</p>
<p>සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව</p>	<p>26.1</p>
<p>සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව, සමස්ත පාලන කමිටුව</p>	<p>36.1</p>

7.1.3 የግብርና ሚኒስቴር ግብርና ቢሮ (ሰነድ-3)

7.1.4 የግብርና ሚኒስቴር (ሰነድ-4)

7.1.5 የግብርና ሚኒስቴር (ሰነድ-5)

7.1.6 የግብርና ሚኒስቴር (ሰነድ-6)

7.1.7 የግብርና ሚኒስቴር (ሰነድ-7)

8.1 የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ

8.2 የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ

8.3 የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ

9.1 የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ

9.2 የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ

(ሰነድ) የግብርና ሚኒስቴር ግብርና ቢሮ

10.1 የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ

11.1 የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ

12.1 የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ

12.2 የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ

13.1 የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ የግብርና ሚኒስቴር ግብርና ቢሮ

13.2. רישום המסמכים המיועדים לפרויקט המיושם במסגרת התוכנית המיושמת במסגרת התוכנית המיושמת.

14.1. מדריך למתנסים, מדריך למתנסים, מדריך למתנסים, מדריך למתנסים 45 תרומה תרומה תרומה תרומה.

15.1. מדריך למתנסים, מדריך למתנסים, מדריך למתנסים, מדריך למתנסים 15.1.1 תרומה תרומה תרומה תרומה.

15.1.2 תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה.

15.1.3 תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה.

15.1.4 תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה.

15.1.5 תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה.

15.1.6 תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה.

15.1.7 תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה.

15.1.8 תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה.

15.1.9 תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה.

15.1.10 תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה תרומה.

15.2. מדריך למתנסים, מדריך למתנסים, מדריך למתנסים, מדריך למתנסים

16.2.1 מדריך למתנסים, מדריך למתנסים, מדריך למתנסים, מדריך למתנסים

29.2 ምርመራውን በሚመለከት ለሁለት ወራት ውስጥ የሚከፈለውን ስም ለመደብዳቤ ምርመራ ማድረግ ይኖርበት ይገባል። ምርመራውን ለማድረግ የሚያስፈልገውን ደብዳቤ በሁለት ወራት ውስጥ ማስገባት ይኖርበት ይገባል።

29.3 ምርመራውን በሚመለከት ለሁለት ወራት ውስጥ የሚከፈለውን ስም ለመደብዳቤ ምርመራ ማድረግ ይኖርበት ይገባል። ምርመራውን ለማድረግ የሚያስፈልገውን ደብዳቤ በሁለት ወራት ውስጥ ማስገባት ይኖርበት ይገባል።

30.1 ተገቢውን ስም ለማስገባት የሚያስፈልገውን ደብዳቤ 17.09 ዓ.ም በኋላ ማስገባት ይኖርበት ይገባል። ስም ለማስገባት የሚያስፈልገውን ደብዳቤ በ13-K/CIR/2018/01 ስም ለማስገባት የሚያስፈልገውን ደብዳቤ ማስገባት ይኖርበት ይገባል።

30. ደብዳቤ
የሚገኝበት
ደብዳቤ

30.2 ተገቢውን ስም ለማስገባት የሚያስፈልገውን ደብዳቤ 17.09 ዓ.ም በኋላ ማስገባት ይኖርበት ይገባል። ስም ለማስገባት የሚያስፈልገውን ደብዳቤ በ13-K/CIR/2018/01 ስም ለማስገባት የሚያስፈልገውን ደብዳቤ ማስገባት ይኖርበት ይገባል።

30.3 ተገቢውን ስም ለማስገባት የሚያስፈልገውን ደብዳቤ 17.09 ዓ.ም በኋላ ማስገባት ይኖርበት ይገባል። ስም ለማስገባት የሚያስፈልገውን ደብዳቤ በ13-K/CIR/2018/01 ስም ለማስገባት የሚያስፈልገውን ደብዳቤ ማስገባት ይኖርበት ይገባል።

30.4 ተገቢውን ስም ለማስገባት የሚያስፈልገውን ደብዳቤ 17.09 ዓ.ም በኋላ ማስገባት ይኖርበት ይገባል። ስም ለማስገባት የሚያስፈልገውን ደብዳቤ በ13-K/CIR/2018/01 ስም ለማስገባት የሚያስፈልገውን ደብዳቤ ማስገባት ይኖርበት ይገባል።

31.1. *කොමසාරිස්වරයාගේ* 17.11 යන දින සංවර්ධන කොමසාරිස්වරයාගේ නිවැරදි කරනු ලබන *පරිපූරක කොමසාරිස්වරයාගේ* කාර්යයන් කෙරෙහි ප්‍රතිචාරයක් ලෙසින් *පරිපූරක කොමසාරිස්වරයාගේ* *ප්‍රකාශනයේ* “*විකේන්ද්‍රීකරණ කොමසාරිස්වරයාගේ*” *පරිපූරක කොමසාරිස්වරයාගේ* *ප්‍රකාශනයේ* 13-K/CIR/2018/01 *පරිපූරක කොමසාරිස්වරයාගේ* *ප්‍රකාශනයේ* “*විකේන්ද්‍රීකරණ කොමසාරිස්වරයාගේ*” *පරිපූරක කොමසාරිස්වරයාගේ* 21 වන කොටසේ “*විකේන්ද්‍රීකරණ කොමසාරිස්වරයාගේ*” *පරිපූරක කොමසාරිස්වරයාගේ* *ප්‍රකාශනයේ* “*විකේන්ද්‍රීකරණ කොමසාරිස්වරයාගේ*” - *පරිපූරක කොමසාරිස්වරයාගේ* *ප්‍රකාශනයේ* PR-16 *පරිපූරක කොමසාරිස්වරයාගේ* *ප්‍රකාශනයේ*.

3 - ስራዎች

ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ማህተም ለማድረግ የሚያስፈልጉትን ደብዳቤዎች ይጻፉ

32.1 ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ማህተም ለማድረግ የሚያስፈልጉትን ደብዳቤዎች ይጻፉ

32.2 ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ማህተም ለማድረግ የሚያስፈልጉትን ደብዳቤዎች ይጻፉ

32.3 ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ማህተም ለማድረግ የሚያስፈልጉትን ደብዳቤዎች ይጻፉ

32.4 ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ማህተም ለማድረግ የሚያስፈልጉትን ደብዳቤዎች ይጻፉ

32.5 ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ማህተም ለማድረግ የሚያስፈልጉትን ደብዳቤዎች ይጻፉ

33.1 ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ማህተም ለማድረግ የሚያስፈልጉትን ደብዳቤዎች ይጻፉ

33.2 ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ማህተም ለማድረግ የሚያስፈልጉትን ደብዳቤዎች ይጻፉ

33.3 ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ማህተም ለማድረግ የሚያስፈልጉትን ደብዳቤዎች ይጻፉ

34.1 ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ማህተም ለማድረግ የሚያስፈልጉትን ደብዳቤዎች ይጻፉ

34.2 ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ማህተም ለማድረግ የሚያስፈልጉትን ደብዳቤዎች ይጻፉ

35.1 ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ማህተም ለማድረግ የሚያስፈልጉትን ደብዳቤዎች ይጻፉ

שם הספר - 4

ענין החוק

ענין חוק - 1

שם הספר והענין הספציפי בפרק המשפטי - חוקי מערכת המשפט, חוקי מערכת הבריאות, חוקי מערכת הרווחה.

#	שם הספר והענין הספציפי בפרק המשפטי
שם הספר והענין הספציפי בפרק המשפטי	
1	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 1)
2	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 2)
3	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 3)
4	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 4)
5	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 5)
6	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 6)
7	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 7)
8	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 8)
9	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 9)
10	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 10)
11	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 11)
שם הספר והענין הספציפי בפרק המשפטי	
12	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 12)
13	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 13)
שם הספר והענין הספציפי בפרק המשפטי	
14	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 14)
15	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 15)
16	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 16)
17	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 17)
שם הספר והענין הספציפי בפרק המשפטי	
18	שם הספר והענין הספציפי בפרק המשפטי (ענין 18)



3 - قىسىم

ئىشلىتىش ۋە تەكشۈرۈش رەھبەرلىكى

1. ئىشلىتىش ۋە تەكشۈرۈش رەھبەرلىكى		
-1.1	سېتىش	
-1.2	مەھسۇلات ۋە خىزمەت ئىشلىرىنىڭ تەكشۈرۈش رەھبەرلىكى	
-1.3	مەھسۇلات ۋە خىزمەت ئىشلىرىنىڭ تەكشۈرۈش رەھبەرلىكى	
-1.4	مەھسۇلات ۋە خىزمەت ئىشلىرىنىڭ تەكشۈرۈش رەھبەرلىكى	
-1.5	مەھسۇلات ۋە خىزمەت ئىشلىرىنىڭ تەكشۈرۈش رەھبەرلىكى	
-1.6	مەھسۇلات ۋە خىزمەت ئىشلىرىنىڭ تەكشۈرۈش رەھبەرلىكى	
-1.7	مەھسۇلات ۋە خىزمەت ئىشلىرىنىڭ تەكشۈرۈش رەھبەرلىكى	
-1.8	مەھسۇلات ۋە خىزمەت ئىشلىرىنىڭ تەكشۈرۈش رەھبەرلىكى	
2. ئىشلىتىش ۋە تەكشۈرۈش رەھبەرلىكى (مەھسۇلات ۋە خىزمەت ئىشلىرىنىڭ تەكشۈرۈش رەھبەرلىكى، مەھسۇلات ۋە خىزمەت ئىشلىرىنىڭ تەكشۈرۈش رەھبەرلىكى)		
#	سېتىش	دەرىجە
	مەھسۇلات ۋە خىزمەت ئىشلىرىنىڭ تەكشۈرۈش رەھبەرلىكى	
	مەھسۇلات ۋە خىزمەت ئىشلىرىنىڭ تەكشۈرۈش رەھبەرلىكى	
	مەھسۇلات ۋە خىزمەت ئىشلىرىنىڭ تەكشۈرۈش رەھبەرلىكى	
3. ئىشلىتىش ۋە تەكشۈرۈش رەھبەرلىكى		

4 - جَوَابَاتُ

جَوَابَاتُ سَوَدِيَّةِ الْعَرَبِيَّةِ

سَوَدِيَّةُ الْعَرَبِيَّةِ، مَدِيْنَةُ رِيَّادِ، اَلْمَكْتَبَةُ الْعِلْمِيَّةُ، اَلْمَكْتَبَةُ الْعِلْمِيَّةُ			
#	اَلْمَدْرَسَةُ	اَلْمَدْرَسَةُ	اَلْمَدْرَسَةُ (اَلْمَدْرَسَةُ)
	جَوَابَاتُ		
سَوَدِيَّةُ الْعَرَبِيَّةِ، مَدِيْنَةُ رِيَّادِ، اَلْمَكْتَبَةُ الْعِلْمِيَّةُ، اَلْمَكْتَبَةُ الْعِلْمِيَّةُ			
#	اَلْمَدْرَسَةُ	اَلْمَدْرَسَةُ	اَلْمَدْرَسَةُ (اَلْمَدْرَسَةُ)
	جَوَابَاتُ		

بعض قیود - 5

قریباً 3 (تین) اصولی امور کے متعلق بعض قیود اور ضوابط

ذاتی و عملی زندگی کے لیے اسلامی احکامات پر مشتمل مفت آن لائن مکتبہ				
#	ضابطہ جاری کرنے والا ادارہ	ضابطہ جاری کرنے کی تاریخ	ضابطہ جاری کرنے کی وجہ	
جمعہ				

6 - تۈرۈم

مۆھرىم ۋە دېھقانچىلىق مەھسۇلاتلىرىنى تەكشۈرۈش

تۈرۈم نومۇرى	تۈرۈم ئىسمى	تۈرۈم تەسۋىرى
70	مۆھرىم	مۆھرىم ۋە دېھقانچىلىق مەھسۇلاتلىرىنى تەكشۈرۈش 70 (مۆھرىم ۋە دېھقانچىلىق مەھسۇلاتلىرىنى تەكشۈرۈش)
5	دېھقانچىلىق مەھسۇلاتلىرى	مۆھرىم ۋە دېھقانچىلىق مەھسۇلاتلىرىنى تەكشۈرۈش 5 (دېھقانچىلىق مەھسۇلاتلىرىنى تەكشۈرۈش)
10	دېھقانچىلىق مەھسۇلاتلىرى	مۆھرىم ۋە دېھقانچىلىق مەھسۇلاتلىرىنى تەكشۈرۈش 10 (دېھقانچىلىق مەھسۇلاتلىرىنى تەكشۈرۈش)
15	دېھقانچىلىق مەھسۇلاتلىرى	مۆھرىم ۋە دېھقانچىلىق مەھسۇلاتلىرىنى تەكشۈرۈش 15 (دېھقانچىلىق مەھسۇلاتلىرىنى تەكشۈرۈش)
100	جەمئىي	

ބަންދުގެ ފޯމް

Form of Bid Security (Bank Guarantee)

WHEREAS,[name of Bidder] (hereinafter called “the Bidder”) has submitted his Bid for the Project no.....issued by the Ministry of Finance and Treasury onfor construction of[name of Contract] (hereinafter called “the Bid”).

KNOW ALL PEOPLE by these presents that We [name of Bank] of [name of country] having our registered office at (hereinafter called “the Bank”) are bound unto[name of Purchaser] (hereinafter called “the Purchaser”) in the sum of *..... for which payment well and truly to be made to the said Purchaser, the Bank binds itself, its successors, and assigns by these presents.

SEALED with the Common Seal of the said Bank thisday of20.....

THE CONDITIONS of this obligation are:

- (1) If, after Bid opening, the Bidder withdraws his Bid during the period of Bid validity specified in the Form of Bid;
or
(2) If the Bidder having been notified of the acceptance of his Bid by the Purchaser during the period of Bid validity:
(a) fails or refuses to execute the Form of Agreement in accordance with the Instructions to Bidders, if required; or
(b) fails or refuses to furnish the Performance Security, in accordance with the Instruction to Bidders; or
(c) does not accept the correction of the Bid Price pursuant to Clause 27,

* The Bidder should insert the amount of the Guarantee in words and figures denominated in Maldivian Rufiyaa. This figure should be the same as shown in Clause 16.1 of the Instructions to Bidders.

we undertake to pay to the Purchaser up to the above amount upon receipt of his first written demand, without the Purchaser’s having to substantiate his demand, provided that in his demand the Purchaser will note that the amount claimed by him is due to him owing to the occurrence of one or any of the three conditions, specifying the occurred condition or conditions.

This Guarantee will remain in force up to and including the date days after the deadline for submission of bids as such deadline is stated in the Instructions to Bidders or as it may be extended by the Purchaser, notice of which extension(s) to the Bank is hereby waived. Any demand in respect of this Guarantee should reach the Bank not later than the above date.

DATE..... SIGNATURE OF THE BANK

WITNESS SEAL

[signature, name, and address]

8 - ބަންދު

ބަންދުގެ ފޯމް

Form of Performance Bank Guarantee (Unconditional)

To: [name & address of Purchaser]

WHEREAS [name and address of Supplier] (hereinafter called "the Supplier") has undertaken, in pursuance of Contract No. dated to execute [name of Contract and brief description of Works] (hereinafter called "the Contract");

AND WHEREAS it has been stipulated by you in the said Contract that the Supplier shall furnish you with a Bank Guarantee by a recognized bank for the sum specified therein as security for compliance with his obligations in accordance with the Contract;

AND WHEREAS we have agreed to give the Supplier such a Bank Guarantee;

NOW THEREFORE we hereby affirm that we are the Guarantor and responsible to you, on behalf of the Supplier, up to a total of *..... [amount of Guarantee] [amount in words], such sum being payable in the types and proportions of currencies in which the Contract Price is payable, and we undertake to pay you, upon your first written demand and without cavil or argument, any sum or sums within the limits of [amount of Guarantee] as aforesaid without your needing to prove or to show grounds or reasons for your demand for the sum specified therein.

*An amount is to be inserted by the Guarantor, representing the percentage of the Contract Price specified in the Contract, in Maldivian Rufiyaa.

We hereby waive the necessity of your demanding the said debt from the Supplier before presenting us with the demand.

We further agree that no change or addition to or other modification of the terms of the Contract or of the Works to be performed there under or of any of the Contract documents which may be made between you and the Supplier shall in any way release us from any liability under this Guarantee, and we hereby waive notice of any such change, addition, or modification.

This Guarantee shall be valid until the date of issue of the Defects Correction Certificate.

SIGNATURE AND SEAL OF THE GUARANTOR

Name of Bank

Address

Date

9 - ބަޔާންކޮށްފައިވާ

ފޯމް ގޮތުގައި ބަޔާންކޮށްފައިވާ ބަޔާންކޮށްފައިވާ

Form of Bank Guarantee for Advance Payment

To:
[name & address of Purchaser]
.....
.....

[name of Contract]

Gentlemen:

In accordance with the provisions of the Conditions of Contract, of the above-mentioned Contract,
.....[name and address of Supplier] (hereinafter
called "the Supplier") shall deposit with
..... [name of Purchaser] a Bank Guarantee to guarantee his proper and faithful performance
under the said Clause of the Contract in an amount of[amount of Guarantee]
.....[amount in words].

We, the
[Bank or Financial Institution], as instructed by the Supplier, agree unconditionally and irrevocably to guarantee
as primary obligator and not as Surety merely, the payment to
[name of Purchaser] on his first demand without whatsoever right of objection on our part and without his first
claim to the Supplier, in the amount not exceeding *.....
[amount of Guarantee]..... [amount in words].

We further agree that no change or addition to or other modification of the terms of the Contract or of Works to
be performed there under or of any of the Contract documents which may be made between
.....[name of Purchaser] and the Supplier, shall in any
way release us from any liability under this Guarantee, and we hereby waive notice of any such change, addition,
or modification.

* An amount is to be inserted by the Bank or Financial Institution representing the amount of
the Advance Payment, in Maldivian Rufiyaa.

This Guarantee shall remain valid and in full effect from the date of the advance payment under the Contract
until[name of Purchaser] receives full repayment of the same
amount from the Supplier.

Yours truly,
SIGNATURE AND SEAL:
NAME & ADDRESS OF BANK/INSTITUTION

سُورَةُ الْوَعْدِ - 5

مَدْرَسَةُ الْوَعْدِ وَالْوَعْدِ الْمَعْرُوفِ	
مَدْرَسَةُ الْوَعْدِ وَالْوَعْدِ الْمَعْرُوفِ	مَدْرَسَةُ الْوَعْدِ وَالْوَعْدِ الْمَعْرُوفِ
مَدْرَسَةُ الْوَعْدِ وَالْوَعْدِ الْمَعْرُوفِ	33.1
مَدْرَسَةُ الْوَعْدِ وَالْوَعْدِ الْمَعْرُوفِ	33.2
مَدْرَسَةُ الْوَعْدِ وَالْوَعْدِ الْمَعْرُوفِ	33.3
مَدْرَسَةُ الْوَعْدِ وَالْوَعْدِ الْمَعْرُوفِ	33.4
مَدْرَسَةُ الْوَعْدِ وَالْوَعْدِ الْمَعْرُوفِ	37

6- نۆۋەت

تېماتىسى

«ئۆزىڭىزنىڭ تېخنىكىسى» دېھقانچىلىق تېخنىكىسى، سۆزلىشىش، سۆزلىشىش ئارقىلىق، ئۆز ئارا مۇناسىۋەتلىك
 دېھقانچىلىق تېخنىكىسى، سۆزلىشىش، سۆزلىشىش ئارقىلىق، ئۆز ئارا مۇناسىۋەتلىك دېھقانچىلىق تېخنىكىسى، سۆزلىشىش، سۆزلىشىش ئارقىلىق، ئۆز ئارا مۇناسىۋەتلىك

تېماتىسى دېھقانچىلىق تېخنىكىسى، سۆزلىشىش، سۆزلىشىش ئارقىلىق، ئۆز ئارا مۇناسىۋەتلىك
 «ئۆزىڭىزنىڭ تېخنىكىسى» دېھقانچىلىق تېخنىكىسى، سۆزلىشىش، سۆزلىشىش ئارقىلىق، ئۆز ئارا مۇناسىۋەتلىك
 دېھقانچىلىق تېخنىكىسى، سۆزلىشىش، سۆزلىشىش ئارقىلىق، ئۆز ئارا مۇناسىۋەتلىك

«ئۆزىڭىزنىڭ تېخنىكىسى» دېھقانچىلىق تېخنىكىسى، سۆزلىشىش، سۆزلىشىش ئارقىلىق، ئۆز ئارا مۇناسىۋەتلىك
 دېھقانچىلىق تېخنىكىسى، سۆزلىشىش، سۆزلىشىش ئارقىلىق، ئۆز ئارا مۇناسىۋەتلىك

«ئۆزىڭىزنىڭ تېخنىكىسى» دېھقانچىلىق تېخنىكىسى، سۆزلىشىش، سۆزلىشىش ئارقىلىق، ئۆز ئارا مۇناسىۋەتلىك
 دېھقانچىلىق تېخنىكىسى، سۆزلىشىش، سۆزلىشىش ئارقىلىق، ئۆز ئارا مۇناسىۋەتلىك

تېماتىسى	تېماتىسى
سۆز:	سۆز:
مەنى:	مەنى:
دەرىجە:	دەرىجە:
مەزمۇن:	مەزمۇن:
تېماتىسى:	تېماتىسى:
سۆز:	سۆز:
مەنى:	مەنى:
دەرىجە:	دەرىجە:
مەزمۇن:	مەزمۇن:
تېماتىسى:	تېماتىسى:
سۆز:	سۆز:
مەنى:	مەنى:
دەرىجە:	دەرىجە:
مەزمۇن:	مەزمۇن:
تېماتىسى:	تېماتىسى:
سۆز:	سۆز:
مەنى:	مەنى:
دەرىجە:	دەرىجە:
مەزمۇن:	مەزمۇن:
تېماتىسى:	تېماتىسى:
سۆز:	سۆز:
مەنى:	مەنى:
دەرىجە:	دەرىجە:
مەزمۇن:	مەزمۇن:

المواد 7

- قائمة المواد / الأجهزة / البرامج المطلوبة

المواد / الأجهزة / البرامج المطلوبة

✓ مواد / أجهزة / برامج إضافية مطلوبة للمواد المطلوبة.

✓ مواد / أجهزة / برامج إضافية مطلوبة للمواد المطلوبة (بموجب شروطها الخاصة) من الشركات الموزعة.

✓ مواد / أجهزة / برامج إضافية مطلوبة 1 ارجع ذاتها.

Material for Electrical and Electronics Programs

Items	Description	Quantity
1	100W CO2 LASER ENGRAVING MACHINE	1 PCS

100W CO2 Laser Engraving Machine

900x600mm CO2 Laser Engraving Engraver Machine 100W USB Disk Ruida Controller

Specifications:

- Working Size: 35.4"x23.6" (90x60cm) with unlimited length
- Laser Power: 100W
- Idling speed: 1-400mm / s
- Engraving speed: 1-600mm / s
- Cutting speed: 1-400mm / s
- Resolution: 2000 DPI
- Location Precision: 0.01mm
- Engraving cutting depth: 0-10mm
- Machine Dimension(L/W/H):59"*42.5"*43.3" (150*108*110cm)